

બેન્ક ઓફ મહારાષ્ટ્ર વ્યક્તિગત લોન અરજી ફોર્મ

પ્રતિ,
બ્રાન્ચ મેનેજર
બેન્ક ઓફ મહારાષ્ટ્ર

ફોટોગ્રાફ - ઉધાર લેનાર	ફોટોગ્રાફ - જામીનદાર

માનનીય સર / મેડમ,

વિષય: વ્યક્તિગત લોન માટે અરજી

હું/અમે આપને વિનંતી કરીએ છીએ કે રૂ. _____ ની વ્યક્તિગત લોન મંજૂર કરો, જેનો હેતુ _____ છે.
મારા/અમારા સંબંધમાં નીચેની વિગતો પ્રસ્તાવના વિચાર માટે રજૂ કરવામાં આવે છે.

વિશેષતાઓ	કરજદાર
1. સંપૂર્ણ નામ	
2. ઉંમર / જન્મ તારીખ	____ વર્ષ D D M M Y Y Y Y
3. પિતાનું/પતિનું નામ	
4. વર્તમાન રહેઠાણનું સરનામું	
5. કાયમી રહેઠાણનું સરનામું	
6. રહેઠાણનો ટેલિફોન નં.	
7. મોબાઇલ નં.	
8. ઇમેઇલ આઇડી	
9. આધાર નંબર	

વિશેષતાઓ	કરજદાર
10. પાન નંબર (આઈ.ટી. વિભાગ દ્વારા આપેલ)	
11. પાસપોર્ટ નંબર જારી કરવાની તારીખ:	D D M M Y Y Y Y
12. શૈક્ષણિક લાયકાત	
13. પગાર ખાતા નંબર	
14. અવિવાહિત કે વિવાહિત	
15. આધારિત લોકોની સંખ્યા	
16. પોતાનું કે ભાડાનું ઘર	

વ્યવસાયની વિગતો | કરજદાર

વિશેષતાઓ	કરજદાર
વ્યવસાય	☐ નોકરીયાત ☐ સ્વરોજગાર વ્યવસાયિક
જો સ્વરોજગાર વ્યવસાયિક હોય:	☐ ડૉક્ટર ☐ CA / CS ☐ આર્કિટેક્ટ ☐ અન્ય
નિયામકનું નામ	
નિયામકની શ્રેણી	☐ સરકાર / અર્ધસરકારી ☐ જાહેર લિ. કંપની ☐ પ્રાઇવેટ લિ. કંપની ☐ મલ્ટીનેશનલ કંપની ☐ પ્રતિષ્ઠિત સંસ્થા ☐ પ્રોપ્રાયટરશિપ / પાર્ટનરશિપ ફર્મ ☐ અન્ય: _____
નિયામકનું સરનામું તથા ટેલિફોન નંબર વેબસાઇટ ઇમેઇલ આઇડી	
હોદ્દો	
હાલના વ્યવસાયમાં વર્ષોની સંખ્યા	
નિવૃત્તિની તારીખ	
અગાઉની નોકરીની વિગતો	
સેવાના વર્ષોની અવધિ	
પગાર ખાતા નંબર અને બેંકનું નામ	ખાતા નંબર: શાખાનું નામ: બેંકનું નામ:
	કરજદાર

વ્યવસાય / કંપનીનું નામ	
કાર્યાલયનું સરનામું	
છમેછલ આઈડી	
ફોન નંબર	
સ્થાપના થયેલી તારીખથી	
વ્યવસાયની વિગતો	☐ પ્રા. લિ. (Pvt Ltd) ☐ એલ.એલ.પી. (LLP) ☐ પ્રોપ્રાયટરશિપ ☐ પાર્ટનરશિપ ☐ અન્ય, કૃપા કરીને જણાવો: _____
મંજૂર લાઈસન્સ (જો હોય)	મંજૂરી આપનાર સત્તા: _____ નંબર: _____

આવક હિસાબ

વિશેષ વિગતો	કરજદાર
મોટી પગાર / મહિને આવક (પગાર શીટ / IT રિટર્ન, ફોર્મ નં. 16 જોડેલ)	
કાપણીઓ આવક વેરો	
વ્યવસાયિક વેરો	
ભવિષ્ય નિધિ	
વીમા પ્રીમિયમ	
અન્ય કાનૂની કપાતો	
શુદ્ધ પગાર / માસિક આવક	
અન્ય આવક (જો હોય, પુરાવા જોડવા)	

હાલના લોનની વિગતો

વિશેષ વિગતો	કરજદાર	
	I	II
બેંક / શાખાનું નામ		
લેવામાં આવેલ લોનનો પ્રકાર		
લેવામાં આવેલ લોનની રકમ		
હાલમાં બાકી રકમ		
સુરક્ષા (જો હોય)		
યુકવણી યોજના		
ડિફોલ્ટની રકમ (જો હોય)		

અન્ય બાકી રકમની વિગતો

વિશેષ વિગતો	કરજદાર
નિયામક પાસેથી લીધેલું લોન	
મિત્રો / પરિવારના સભ્યો પાસેથી લીધેલું લોન	
વેચનાર પાસેથી ઊભી કરેલી સામગ્રી / મિલકત (ઉધાર)	
અન્ય બાકી રકમ	
કુલ બાકી રકમ (A)	

મિલકતની વિગતો

વિશેષ વિગતો	કરજદાર
રોકડ	
બેંકમાં થાપણ	
અસ્થાવાર મિલકત / પ્રોપર્ટી (સરનામું અને કિંમત સાથે)	
સ્થાવર મિલકત	
રોકાણ (દરેકને અલગથી લખો)	
અન્ય (ફૂપા કરીને જણાવો)	
કુલ મિલકત (B)	
શુદ્ધ મૂલ્ય (B-A)	

પ્રસ્તાવિત લોનની વિગતો

માગેલી લોનની રકમ	
ઉદ્દેશ્ય	
ચુકવણી સમયગાળો	

હું જાહેર કરું છું કે ઉપર આપેલી બધી વિગતો અને માહિતી સાચી, યોગ્ય અને સંપૂર્ણ છે. હું ખાતરી આપું છું કે હું કોઈ નાણાકીય સંસ્થા / બેંકનો ડિફોલ્ટર નથી અને મારા / અમારા વિરુદ્ધ કોઈ વસૂલી કેસ બાકી નથી. હું વધુમાં ખાતરી આપું છું કે મારી / અમારી સામે કોઈ દિવાળિયા જાહેર કરવાની કાર્યવાહી ચાલી રહી નથી કે ક્યારેય થઈ નથી. હું જાહેર કરું છું કે લોનની રકમ કોઈપણ સદ્વાબાજી હેતુ માટે ઉપયોગમાં લેવામાં નહીં આવે. હું સંમત છું કે મારી / અમારી લોન બેંકના નિયમો હેઠળ રહેશે, જે સમયાંતરે અમલમાં રહેશે.

તારીખ: _____

સહી: અરજદાર: _____

વ્યક્તિગત લોન માટે ચેકલિસ્ટ

1. અરજી ફોર્મ પૂર્ણપણે ભરેલું અને સહી કરેલું
2. બે પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ્સ

3. ફોટો ઓળખ પુરાવો

- I. પાસપોર્ટ
- II. પાન કાર્ડ
- III. મતદાર ઓળખ કાર્ડ
- IV. ડ્રાઇવિંગ લાઇસન્સ
- V. આધાર કાર્ડ

4. રહેઠાણનું સરનામું પુરાવો

- I. પાસપોર્ટ
- II. રેશન કાર્ડ
- III. યુટિલિટી બિલ: વીજળી બિલ / લેન્ડલાઇન બિલ
- IV. આધાર કાર્ડ
- V. મતદાર ઓળખ કાર્ડ
- VI. ડ્રાઇવિંગ લાઇસન્સ

5. આવક પુરાવો

નોકરીયાત

- I. છેલ્લા 3 મહિનાની પગાર સ્લિપ
- II. છેલ્લું ફોર્મ 16 / છેલ્લા બે વર્ષનું ITR
- III. છેલ્લા 6 મહિનાનું બેંક સ્ટેટમેન્ટ (અન્ય બેંકના કેસમાં)
- IV. માસિક પગાર જમા કરવા માટે નિયામક તરફથી પ્રમાણપત્ર (જ્યાં શક્ય હોય ત્યાં)

સ્વરોજગારી

- I. છેલ્લા બે વર્ષનું ITR (સ્વરોજગારી વ્યક્તિ) / ત્રણ વર્ષનું ITR (અન્ય વ્યવસાયિક લોકો માટે), જેમાં આવક, નફો અને નુકસાન ખાતું, બેલેન્સ શીટ, ઓડિટ રિપોર્ટ વગેરેનો સમાવેશ થાય
- II. દુકાન સ્થાપના કાયદો
- III. કોઇપણ ટેક્સ રજીસ્ટ્રેશન નકલ
- IV. રજીસ્ટ્રેશન લાઇસન્સ (જ્યાં લાગુ પડે ત્યાં)
- V. છેલ્લા 6 મહિનાનું બેંક સ્ટેટમેન્ટ (અન્ય બેંકના કેસમાં)